

25th January, 2025

To, National Stock Exchange of India Limited Exchange Plaza Plot no. C/1, G Block, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai - 400 051 **NSE Symbol: JINDWORLD** To, BSE Limited Listing Department Phiroz Jeejeebhoy Tower 25th Floor, Dalal Street, Mumbai - 400 001 Security Code: 531543

Dear Sir/Madam,

Subject: Submission of Newspaper Publications – 25th January, 2025

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, please find enclosed herewith a copy of Newspaper Publications published on 25th January, 2025, regarding sending of Corrigendum to Postal Ballot Notice dated 7th January, 2025, in the following newspapers:

1. Indian Express - English Edition;

2. Financial Express - Gujarati Edition.

You are requested to take note of the above.

Thanking you.

Yours faithfully,

For Jindal Worldwide Limited


Vikram Oza CFO & Director DIN: 01192552

Encl.: As above



"Jindal House"

Shyamal Shivranjani Road, IOC Petrol Pump Lane, Opp. D-Mart, Ahmedabad - 380015, Gujarat (India) +91-79-71001500 info@jindalindustries.com www.jindaltextiles.com CIN : L17110GJ1986PLC008942 GSTIN/UIN : 24AAACJ3816G1ZX



for. The envelope containing the application must be clearly marked with the position and location applied for*** CBC 25113/12/0154/242

Place · Vadodara

Date : 24.01.2025

Transpek Transpek Industry Limited CIN: L23205GJ1965PLC001343 agd. Office : 4th Floor, Lillena 1038, Gotri-Sevasi Road


Regd. Office : 4th Floor, Lilleter 1038, Goth-Sevasi Read, Vadodara - 30021. IOTICE NOTICE IS HEREBY GIVEN THAT a meeting of the Board of Directors will be hald on Monday. the 10² February, 2025 through Audio-Kisual means to consider and approve the Unaudiet Standaroben and Consolidated Financial Results of the Company for the third quater ended on 31⁴ December, 2024 as required under Regulation 33 of the SEBI(LODR) Regulations, 2015. For Transcele function:

PUBLIC NOTICE

Sevasi Road

Ala Company Secretary & Complia

For Transpek Industry Limited Alak D. Vyas



Tel: 011-2306173

WWW.INDIANEXPRESS.COM

CBC-17101/11/0018/2425

Quarter Ended	ed December 31, [₹ in crores ex Nine Months Ended December 31, 2024 Unaudited	cept per share data Quarter Ended
ecember 31, 2024 Unaudited	December 31, 2024 Unaudited	December 31, 2023
Unaudited	Unaudited	<i>,</i>
2809		
	8557	2732
691	2008	543
691	2008	631
503	1413	443
433	1284	442
169.23	169.23	169.23
14.88	41.76	13.10
14.88	41.76	13.10
	691 503 433 169.23 14.88 14.88 rerve as on Mare financial results puarter Ended	691 2008 503 1413 433 1284 169.23 169.23 14.88 41.76

per 31, 2024 December 31, 2024 December 31, 2023 Total Income from operations Profit before tax 430 485 1414 297 Profit after tay 1378 284 Total comprehensive income

2 The Board of Directors in their meeting held on January 24, 2025, recome equity dividend of ₹ 26 per equity share.

To heave is an extract of the detailed format of Financial Results for the quarter and nine months ended December 31, 2024 filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the same, along with the notes, are available on <u>www.nscindin.com</u>, <u>www.bscindin.com</u> and on the Company's website (*RRL*: <u>www.torrentpharmacondinestorisfinancial-info/quarterly-results</u>). The same can be accessed by scanning the QR code provided below.



JINDAL JINDAL WORLDWIDE LIMITED

CIN: L17110G/1986PLC00842 Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, ShivranjariShyamal 132 FL Ring Road, Satellite, Ahmedabad – 380015, Gujarat, India, 5/079-71001500 - Email di: simidal@indatlettles.com · Websfe : www.indatlextles.

CORRIGENDUM TO THE NOTICE OF POSTAL BALLOT DATED 7TH JANUARY, 2025

5

Evolution 2010 The Title Notice of Postal Ballot dated 7" January, 2025 issued to the
shareholders,
This is with reference to the Notice of Postal Ballot dated 7" January, 2025 issued to the
shareholders of Jindal WorkWide Limited (The Company') and ongoing e-volting available
from Friday, 17 January, 2025 do 109:00 AM, (157) which will end on Salurday, 15" February,
2025 at 05:00 PAM, (157). The Notice of Postal Ballot dated 7" January, 2025 (Postal Ballot
Notice') was dispatched via email to the Shareholders of the Company on 16" January, 2025,
in due compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Companies Act, 2013, and turnary, 2025,
indue compliance with the provisions of the Portin n. 7. of Notes to the Postal Ballot
Note, as par the explanation bdow:
The requirement of announcing dates of closure of transfer books in place of record date for
securities held in physical form, for complying with requirements for Issue of Borus Issue of bit
Notes to the Postal Ballot Notee. Bell (LDDR) Requisions, 2015 has been onitited by the SEBI
UOPR (Paulton A2, 0'SEBI (LDDR) Requisions, 2015, has been onitited by the SEBI
UOPA (Not Noth has been onited by the SEBI
UOPR (Paulton A2, 0'SEBI (LDDR) Requisions, 2015, has been onited by the SEBI
UOPA (Not Noth has been onited by the SEBI
UOPR (Paulton A2, 0'SEBI (LDDR) Requisions, 2015, has been onited by the SEBI
UOPR (Paulton A2, 0'SEBI (LDDR) Requisions, 2015, has been onited by

Issue and allotment of Bonus shares." This Contrgendum to the Postal Ballot Notice shall form an integral part of the Postal Ballot Notice, which has already been diriculated to the Shareholders of the Company, and on and from the date breed, the Postal Ballot Notice shall always be read in conjunction (and the theored, the Postal Ballot Notice shall always be read in conjunction with this Congendum. Accordingly, all concerned shareholders, Stock Exchanges, Depositories, regulators, and all other concerned persons are requested to take note of the above changes. All other contents of the Postal Ballot Notice, save and except as modified or supplemented by this Contigendum, shall remain unchanged. This Contigendum dated 24²¹ January, 2025, shall also be available on the Company's website www.indelfateXiles.com, websites of the Stock Exchanges in LBS L limited and National Stock Exchange of India Limited at www.basindla.com and <u>www.nseindla.com</u>, respectively and the e- Voting Service Provider (SSP).

(ESP) This Configendum is being sent only through electronic mode to those Shareholders whose email address is registered with the Company (depository participant(s) as on the cut-off date Le. Friday, 10⁻¹ January, 2025. We would like to Inform all those, who have already castled their votes in the ongoing possibalization is, after the start of e-Voling towards the possibalization but prior to reaction with the Information provided in the Corrigendum. The omission stated in this Configendum is no way resulting In any change in the purpose of Special Businesses and the proposed resolutions thereoit. This Configendum should be read in continuation of and in conjunction with the Postal Ballot notice dated 7⁻¹ January, 2025. The above is for your information and records. For and on behalf of the Board of Directors Start

Vice-Chairman & Managing Director DIN: 00169061

AMIT AGRAWAL

Date : 24[®] January, 2025 Place : Ahmedabad

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

education, healthcare and finance to make growth

ADVERTORIAL Reclaiming Bihar's glory as a destination for education: DMI Patna Redefines Management Education for a Better World, Offers Extensive Scholarships

General Women and Reserved Category Categories

DMI

Management Aptitude Test-score based Scholarships: support for tuition fee

persisted: Bihar, for many aspiring students, is a place to leave, not a destination for quality higher education. The allure of government jobs, however modest, or the perceived prestige of institutions outside the state. Management Aptitude Test - Perc 90 and above Between 80 and 90 Between 70 and 80 Institutions outside the state, even those offering questionable value, has fueled a "brain drain," leaving Bilari's institutions struggling to attract top talent. But in the heart of Patna, a quiet revolution is brewing at the Development Management Institute (DMI), an autonomous institution established by the Government of Bihar. DMI isn' just another management school; it's pioneering a new kind of education that goes beyond the traditional MPA and empowers a new generation of Between 60 and 7 Between 50 and 6 ocyona me traditional MBA and empowers a new generation of leaders to tackle the world's most pressing challenges. Recognising many students' financial constraints, DMI is committed to making this committed to making this comprehensive scholar-support programme.

A Vision Beyond Business as Usual

For years, a narrative has persisted: Bihar, for many

A Vision Beyond Business as Usual DMI's vision is to be "the preferred destination for eross-functional and interdisciplinary education institutions, and practices in development management." This vision and its mission "to ad va a cc é de vel o p m ent mangement knowledge and practices fitnopal collaborative research, education, and impactions through collaborative research, education, and practices fitnopal collaborative research, education and practices through collaborative research, education and practices through collaborative research, education and practices through collaborative research, education and conventional management schools. It's an institution that conventional management schools. Tis an institution that neously on people, planet and provide the state of the state of

DMI Difference: Where Purpose Meets Profit Purpose Meets Profit Take, for example, the field of marketing. A typical MBA program night teach consumer behaviour to manipulate purchasing decisions. It rarely, if ever goes beyond brand level competition. DMI goes deeper. Its courses in the Marketing stream do not confine themselves to brand level abschiution. They set students themselves to brand level substitution. They get students to engage in Product-level competition, enabling them to work towards effecting the 100% 75% 100% 100% nil 25% production and mindful consumption for sustainability. From "Change Agents" "Impact Managers": Redefining Leadership Redefining Leadership Some may hexine, associating "development" with activism and self-assifice. But DMI is changing that perception, Instead of "change agents," DMI graduates are prepared to be "Im pact M an agers" – professionals who understand that social good, economic progress and environmental "eventuality or nonether." sustainability go together

switch from historically ingrained preferences to ones and generative of civic virtues and public good. This includes gamering positive behaviours like interalia, circular economy, sanitation practices, vaccine adoption, and preventive health care – actions that directly simply driving sales of a particular brand. Taking recourse to the fundamentals of Marketing, it en courages students to interrogate value chains, consumption behaviour and learn the technology of are sustainable, just and farm. Deepening democracy, sustainability, and resilience creating positive externalities is central to DMI's education. Deepening democracy, sustainability, and resilience that reading and management bit is fundamentally different. While a traditional management degree confines students to assum ptions of 1 homo economicus' and virtues of member-oriented businesses. It means and wirtues of member-oriented businesses. It means divinesses, it inclusion division differented businesses. The career opportunities for DMI graduates are not confined to functional management roles. They are the baseline opportunities. Beyond them lie roles in, among others: Development programm-ing: Leading development initiatives that make a real Shaping governance systems: Triggering stake-holder participation and democratic practice for the greater good. greater good. Aligning institutional policies & practices for the triple bottom line: Working through internal systems for engendering sustainable and

and build nations with heter education and healthcare infrastructure. Development Management at DMI Patta encourages students to adopt design thinking and harness the latest information technologies to spread growth and property, programs that treat a large section of society only as consumers of goods and services. DMI's PGDM promotes responsible

responsible practices. Social Entrepreneurship: Building enterprises that respond to needs, unlike traditional ones that address damand

Collective Enterprise building: Facilitating institution building for the enterprises of the small and marginal Tech-Techno-entrepreneurship: Harnessing information

learning through their work and the guidance of field mentors. This 70/30 split hetween classroom and in-situ learning ensures that DMI graduates are vell-versed in theory and equipped with the practical skills and insights needed to succeed as Impact Managers. Makine Education Accessible: Making Education Accessible DMI's Core philosophy -scholar support programme DMI is committed to ensuring that financial constraints do no prevent deserving students from prevent deserving students from pursuing this transformative education, nor are students burdened with large debts for their education. The institute offers a wide range of scholar support opportunities.

support opportunities.
 A cademic Performance Scholarships: Up to 100% tuition fee waiver based on term-wise performance.
 University Topper Scholarship: 50% tuition fee waiver for university toppersi may discipline.
 These scholarships demonstrate

'urpose Meets Profit.
DMTs commitment to diversity, attracting and supporting the attracting and supporting the regardless of their financial background. Choosing a Future of Purpose DMI Pattna is not just an institution: it's an ownement. It's institution: it's an ownement. It's and it's duals for user their management cueation and skills to build a more equitable and sustainable world. It's a testament to the fact that Bhar is bub of innovation in education. Studying in the state offers extramunal opportunities to soak in the ancient history of the sub-vision and mission, is shaping a new generation of leaders who will drive positive change from the grassrootsup. Three terms are deviced to Experiential Learning Segments (ELS), immersing students in real-world institutional and organisational meetice Development Immersion (5 weeks): Students are

embedded in rural communities, enabling observation and learning through conversational interactions. Enterprise Learning (6 weeks): Placed with collective and small enterprises, students learn the end-to-end functionalities of enterprises and corresponding business challenges. the grassroots up. Rural Management was just the Beginning - Embrace the Ful Spectrum of Developmen Management at DMI Patna Thus, Beyond Rural, Beyond Tradition al: This is Development Management.



Apply now for DMI Patna's PGDM 2025-27 and become ar Impact Manager who shapes "Sustainable Futures". Ahmedahad

ability. nts'' to economic factors. A Unique Course Structure: Bridging Theory and Practical DMI's PGDM programme is structured to provide a unique blend of theoretical knowledge, both know-why and know-how, and their practical applications. The programme consists of eight academic terms. Five terms are dedicated to Interactive Learning Sessions (ILS), providing a strong management, inter-disciplinary fields and development praxis. There, terms are devoted to



challenges. Management Internship (10 weeks): Coming as it does in the second year, when students have developed early ideas for their future contributions, they choose to be with entities that align the best. They work on a 'business problem' to gain



DMI Difference: A Vision Beyond Business as Usual Where Purpose Meets Profit.


FORM B PUBLIC ANNOUNCEMENT rschvency and Bankrupicy Board of India (Liquidation Process) Regulations, 2016 TON OF THE STAKEHOLDERS OF GO AIRLINES (INDIA) LIMITED RS [DETAILS] TICULAR Name of corporate debtor Go Airlines (India) Limited Corporate Identity No. / Lim Liability Identification No. of porate debtor dress of the registered offic d principal office (if any) of Registered Office Address: Britannia Indust imited A-33 Lawrence Road Industrial Area Limitad, A-33, Lawrence Kosu Internet New Delhi 110035 Principal Office Address: 4th Floor, Kaledonia Building, Sambhaji Nagar, Sahar Road, Andheri Cost, Mumhaj MH 400069 20 January, 2025 ement te of corporate debtor me and registration number Mr. Dinkar T. Venkal IBB//IPA-001//IP-P00 A demission of the second set , mina) Limited Jedonia Building, Sembhaji Negar, , Andheri East, Mumbai MH 400069 gmail.com I Go Airlines (India) Limited 4P Floor, Staledonia Building, Sambhaji Nagar, Sahar Road, Andheri East, Mumbal MH 40006 golfistor@golgmail.com Creditors are requested to submit their clain through the following link: www.gofristclaims.in/squidation 19 February, 2025 et date for a hmission of tible is hereby given that the National Company Law Tribunal, Dehi Bench has ordered immencement of liquidation of Go Airlines (India) Limited on January 20, 2025. meconentrol traduction of Gouldman Bridgel Limited on Jamay 72, 2013. statistication of Gouldman Bridgel Limited and Hospital Licens Jacom Hannel Hospital Bridgel License Jacobia Hospital License Anton Hospital License Anton Hannel Hospital License Anton Hospital License Anton Hospital License Anton Hospital Hospital License Anton Hospital License Anton Hospital License Anton Hospital Hospital License Anton Hospital License Ant e: January 25, 2025 ce: Delhi Mr. Dinkar T. Venkat

Control Line Control Line Control Contro Control Control Cont					
Sr. No.	Folio No.	Name / Joint Names	Shares	Certificate Nos. From • To	Distinctive Nos. From - To
2	46455690 45877558	Jagdeesh Allam Pally Lata Naresh Mehta Sajata Anil Chavda	50 50 100 200 400 50 50 25 25 50 40 10 6 250	62513709-709 66781165-165 47122-123 74684-684 12219381-381 15044902-902 15044902-902 15044902-902 15044904-904 15044904-904 15044905-905	140804073-122 140823056-102 1261923140-239 2211532264-453 6886138662-261 1675726-825 222270-750 251603261-310 2764926-950 2765026-050 2765026-050 2765021-02 251603311-320 251603311-320 251603311-320
Any with Seler Hydi failn certi Place	parson(s) wh the Compar tium Tower trabad - 500 g which, the 0	by warned against purch to has / have any claim in re y's Registrar and Transfe B. Pice No. 31-32, Gs 032, within Seven (7) d Company will proceed to is spect of the aforesaid sect 4, 2025	asing or agard of Agent v chibowli ays from sue lette rities.	the securities, she iz. "KFin Techr , Financial Dist the date of publ er(s) of confirmation or Reliance Indus Sd/- Savithri P.	suld lodge such claim nologies Limited", rict, Nanakramguda, ication of this notice, on in lieu of duplicate tries Limited



ા કા પ્લાય પ્લય પ્લય ઉંચારસતાં / જામીનદારોનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જજ્ઞાવેલ સમય મર્યાદામાં પેટા કલમ કલ્મ ૧૩ સરકેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી બોલાં ભરપાઈ કરી પાઈ

સ્થાવર મિલકતનું વર્ણન





Nomination and Remuneration Committee at their meeting held on 12" November, 2024 and in terms of the members approval dated 19"December. 2024.

This notice shall also be available on the website of the Company at www.ucal.com and on the website of the stock exchanges i.e BSE Limited and National Stock Exchange of India Limited

Any person having any objection(s) to the above may. If he / she so desires commu icate his/her obi Any person intering any operation(s) to the dover may, in the size so doesnes communicate instant operations in wing to the Secretary Minstry of Corporate Affairs, Concentenent of India. A Wing, Shastri Bhawan, Dr. Rajendra Prasad Road, New Delhi - 110 001 within 30 days from the date of publication of this notice and send a copy thereof, to the Company at the above mentioned address.

The DENTRY is desired what when we want much the term of the balance of the status and the statu

મત્યામાં આ વડા તે હતા પુચા પાત અને અને અને તા તાલવા ખાળ તા લાદભા ટલરા . આ તમારા દાઆ પર વાર્લ્યાનું છે કે SARFACES એક્સની કલમ પર (૮૮) ઠેઠતા, જ્યાં સુરક્ષિત લેણદાર દ્વારા કરવામાં આવેલા અ ખપં, આ જે અને ખારે સાથે સુરક્ષિત લેણદારની ભાકી રકમની દકમ અનાદી કોમિલા સમયે સુરક્ષિત લેણદાર ને આપવામ આવે છે . અંદ કડશું / ઠેકડર / આન્યા કોકરા માં એ નીડિસ્ટા પ્રકારભાની લોગી મુ. સુરક્ષિત સંપોલનું ગેશક અભારા સામાંતરણ કરવામાં આવે ન અને તે સુરક્ષિત સંપત્તિમાં સામાતંતરણ અલવા વેચાણ માટે આગળ કોઈ પગલા લેવામાં આવશે નહીં.

Burscholl y ac-Burscholl / Jackun / Juhadatag uni (1) Ghafta unimut gefühen (Bisscholl of Hickscholl and All and All and All and All and and All and and All and and (1) Generation (Bisscholl and All and

 (1) Som graft, ensisting 1 - top-charact sink (Salaza)
 where and the set of the s

માં પુરક્તી કહેતું. આપતાના માં આપતા પાઝે માં માં માં મુખ્ય ગુપ્તા કે મુખ્ય ગુપ્તા ગ

Place : Chennai Date : 24.01.2025

VES BANK and all a share and a share and a

વિદ્યારકર્તાઓ / સદ-ઉદ્યારકર્તાઓ / ગિરવેદારો / પ્રોપરાઇટરનું નામ

By order of the Board For UCAL Limited S. Naravan Company Sec

ડીમાન્ડ નોદીસની તારીખ અને બાકી લેવા સ્ક્રમ

SHileS સીંદારાશા લારાજ જાય ખારા પ્રચ્યા પ્રગ્ન ૧૯.૧૦.૨૦૨૪ રૂ. ૧૬૦૫૦૪૬.૨૪/- (રૂ. સોળ લાન પાંસ હનાર છેતાળી અને સુંબોતેર પૈસા કલ્ડા તા. ૧૯.૧૦.૨૦૨૪ ના રોજ બાકી

นี่เราเล ติโซเตต ลิ้ซ ัย คบกาดปกกล่อกไปกกไ มาวง ร์เนียง, เปาฟ พต, ชิ.ป. วิเยนว, วินย์ว์ ปีขวโร, มาชยิน. Email : cs8304@mb. სიე 📔 🔤

કબજા નોટિસ (અચલિત મિલકતો માટે) કળગા નોટિવેટ (અચલિત બિહલો માટે) આવી, નીચે રહી કરવાર પંચ્ય મેસ્પલ એ લા ના બેદુલ અધલાંગિરે વિક્રવુંદાયમાં અને લેકન્ટરૂકાન એક કામતાઓવલ એરેટ્સ એક એનરેસેસિંગ હેલા ક્લિક્સીરી માન્ટેસ્ટ એક ૮ ૧૦૦૨ ની ધારા ૧૩ થાવે ધ્યાળ વિશ્વા કે દેશના ઉક્સારેટી મંદ્ર-ટેસ્ટ (બેનરેસેસ્ટ) વિશ્વ લા આવેલને વારે દાર્થાળા તારીક સ્પરાર્થ (ગ્રાહાલ) વિશ્વા કે દેશના ઉક્સાર કે દેશના ઉક્સારેટી મંદ્ર-ટેસ્ટ (બેનરેસેસ્ટ) વિશ્વ લા આવેલને વારે દાર્થાળા તારીક સ્પરાર્થ (ગ્રાહાલ) વિશ્વા કે પ્રાર્થ વધા પાલવામાં આવું હતું. કરપ્યદારે, 'બાહિસારી સેટ દાર્થીલ તારીએ ધરોડલ વિશ્વામાં કલા કે દાર્થ કામ કે પ્લાનો આવેલા કે બેઠે દાર્થ કે પ્લાનો કારપાટો, 'બાહિસારી સેટ દાર્થી હતાનો અને બેરોટ લાગો અંગ તે વિશ્વા કે વિશ્વા આપતા છે. તે પ્લેતને વીચે દરસારક દરેશ કરપાટો, 'બાહિસારી સેટ દાર્થી હતાનો અને એટ પ્લાલો સામાન દેશે નીચે દાર્થી દાર્થી સ્પરાર્થ કર્યો બેરે દાર્થી કર્યો કારપાટો, 'બાહિસારી,' મેટોક્સીઓ અને એટ પ્લાલો સામાન દેશે નીચે વિદ્યો છે બાહી સામ અને ચાર લાખ તામ બાને સેટ કરપાટો, 'બાહિસારી,' મેટોક્સીઓ અને એટ પ્લાલો સામાન દેશે નીચે દાર્થી હતાથી આપતા છે ને બેરી દાર્થી અને ચાર લાખ તામ બાને સેટ કરપાટો, 'બાહિસારી,' મેટોક્સીઓ અને એટ પ્લાલો સામાના છે ની મેટી દાર્થી હતાથી સામ બાહી કે નીટે દાર્થીલ હતાન કરાય છે. કરપાટો પાર્થ બાહવા છે વાર્થ બાલે છે લોક સામ છે ની મોટ દાર્થી હતાની કે નીચે દાર્થીન છે બાહે સામ અને ચાર લાખ તામે સાથે 'બેરેશ આ વાર્થ કરવા છે થીનો બેન્સો આવે તરેટે.

(८)	(૮)ની જોગવાઈ તરફ દયાન દોરવામાં આવે છે.			
ક્રમ નં.	ઉઘારકર્તાઓ/ જામીનદારો/ ગીરોકર્તાનું નામ અને શાખા	ડિમાન્ડ નોટિસની તારીખ અને બાકી લેણી રકમ +	અચલિત મિલકતોનું વર્ણન	કબજાની તારીખ/ પ્રકાર/ સ્થળ
1	શ્રી કિશન કનકરાય પંઠયા (ઉદ્યાશ્કતો) અને શ્રી કનકરાય શાંતિલાલ પંઠયા (સહ-ઉદ્યાશ્કતી) શાખા : પોરબંદર એમ.જી. શેક (૩૭૬૭૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૫.૧૦.૨૦૨૪ રૂા. ૩,૯૯,૬૧૪.૩૦ અને તેના પરનું વ્યાજ	ઉલ્લેખિત રહેશાંક ભિલ્કત ? ગામ : આદિવાણા, સર્વે તો 333 અને 337 બેને 337 બેને લુલ ગામીલા વિસ્તાર ૨૯૦-૧-૦ ક રહે.ગી. અને તેમાં ઉપગુલું બોહાકામ. ? ત્રી કનકામ શાંતિભા પંડથા ના ગામને 18. ચ તું (સેમા નાંદેશ નુપળ છે : પૂર્વ : અગલગી માહિની ની મિલ્કત, પ લિમ : રસ્તો, ઉતર : રસ્તો, દ્લિપ્ટા અગલગી માહિનીની મિલ્કત માહિને : સી કલ્ટામ્ય શાંતિલા પંડથા	ર૧.૦૧.૨૦૨૫ // સાંકેતિક આદિત્યાણા
2	શ્રીમતી કકરાર પુષ્પાએન સંજયભાઈ (ઉદ્યારકર્તા) અને શ્રીમતી મેઘનાથી દ્રિભાવેન દિવ્યેશ (સદ- ઉદ્યારકર્તા) શાખા : પોરબંદર એમ.જી. રોક (ઢેક્કેડ૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૯.૧૦.૨૦૨૪ રૂચ. ૯,૮૧,૦૨૧ અને તેના પરનું વ્યાજ	પ્રાથમની શિક્ષ્મોદિવા ક ઉત્પોલિત શિકલતા ૧ છે ભાગ દોડ કાળા, પેપગંડત તારુ પાંક છેલા, ગીદી ગંદે તે પા ગાઢ ઉતી, પાંડી ર તે 3 થી (ગોલાલાંન મોપપી કાં કે મુજબ સોવી ગંદેન પા ગાઢ / ગો, આ તે સે લંગ કાં ગોલા ને ગોલાનો વિસ્તાર પા પા ગાઢ / ગો. આ તે સે બંધું આવ્યું. પા પા ગોલાની શિંદા ના પોલા ક પા ગોલા ના પોલાની વિસ્તાર પોલીની શેલ્લાનાં પ્રાથમિત ક ૨૦ લ કુ કરતો હતા કે દિવા તાં 'બી' તો ખાનાં, દક્ષિકા પારો હતાં તે ગોલાં સાહિતી ક પ્રાપ્તાને હતાં સ્ટાર બાલી હતાં કે સ્ટાર ક્રિટ્ટલે આવ્યું આવ્યું સાથે તો શિંદા છે કાર કે સ્ટાર ક્રિટ્ટલે આવ્યું આવ્યું સાથે તો શિંદા બાલ ક્રાર કે સાથ કે સાથ ક્રાર કે સાથ ક્રાય ક્રાય કે સાથ ક્રાય ક્રાય ક્રાય ક્રાય ક્રાય કે સાથ ક્રાય કે સાથ ક્રાય ક્રાય ક્રાય કે સાથ ક્રાય	ર૧.૦૧.૨૦૨૫ સાંક્રેતિક પોરબંદર
3	શ્રી ઉપેન્દ્ર ફકીરાભાઈ ગોફેલ (ઉદ્યાટક્વી) અને શ્રીમતી ઉપેન્દ્ર ગોફેલ (મોર્ગેજર અને જામીનદાર) થાખા: પોરબંદર (૧૩૩૪૧૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૬.૧૦.૨૦૨૪ રૂા. ૧૨,૪૮,૬૫૯ અને તેના પરનું વ્યાજ	ઉલ્લેમિત પોસ્બંદર શકેર ખાતે સ્પિત રહેવાંક મહાન શરાવતી ભિલ્લા ૧ પોપ્સંટ શકેર, પોબરેટા ગીરી સપી છે તે ગીરી ગાંરે રહે	ર૧.૦૧.૨૦૨૫ / સાંક્રેતિક પોરબંદર
¥	શ્રી મદેતા અશ્વીન વલ્લભાશસ (ઉધારકતી) અને શ્રીપ્રતી મદેતા જ્યોરસના અશ્વીન (સદ- ઉધારકતી) શાખા : પોરબંદર એમ.જી. રોડ (ઢક૬૪૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૦૬.૧.૨૨૨૪ રૂા. ૧૦,૮૯,૪૩૭.૩૮ અને તેના પરનું વ્યાજ	પ્રાથમની દિશ્વગોદિવી : બાત ભાગ, અને અંગ કાઉનની હિલ્લીમિલ Rest : 7 પ્રેલ્સ રૂપી ને ૪૫, * મ્લાકપુરી તરીકે ગોળના ઘરાનની તેશેલાં કેલું પ્રાથિતિ, લોખોરા પાટે તે. ૨૪ લી દર, ગાળ પાટે પ્રાથમિતિ, લોખોરા પાટે તે છે. પ્રાથમિત્ર, પ્રાથમિત્ર આપણા છે. પ્રાથમિત્ર માત્રા : બોખોરા, પ્રાથમિત્ર ગુલ્લા કેલગ, જે અન્યોના લાતાની છે. ૧૯ ભાગ અને જ પ્રાથમિત્ર કાર્ય છે. પ્રાથમિત્ર બાલીલ્ટન પ્રાથમિત્ર ૨૦૦૦ છે. પ્રાથમિત્ર કાર્ય છે. વાત પાટેલ ૮, અને ૨૪ બની તી શિલ્લત, દશિષ્ઠા પ્યાટને, ૮૫- દ્વી ના જ્યોન	ર૧.૦૧.૨૦૨૫ / સાંક્રેતિક / પોરબંદર
ų	મે. પર્વ રોપ્સ (ભાગીદારી પેક્રી) (ઉધારક્તી), શ્રીમતી શમ મનશીશલેન થોગેશભાઈ (મે. પર્વ દોપ્સ ના ભાગીદાર અને મૌર્ગેજર અને જામીનદાર) અને શ્રી અને મૌર્ગેજર અને જામીનદાર) શાખા : પોરબંદર એમ.જી. રોડ (૩૭૬૭૦૦)	ડિમાન્ડ નોટિસ તારીખ : ૧૨.૧૧.૨૦૨૪ રૂં!. ૧,૦૮,૦૫,૧૪૯.૪૨ અને તેના પરનું વ્યાજ	ોમપટેસ શિક્ષ્યોથિતા - સોમોલેસ પોત કાયતા ઉત્સંગીતા બિલલા રેગાસ નાપાણા તાલુકો સાગામાં અથવુ સંચે કર પેકી, પોર તો ર, મ, નાવામાં ઝગપાઇલેની સંસેટ, સ્વાતિના વિવાસ ૧૮૨૨૫૦ કરે.તી. અને તેના ઉપરસ્ સામાં, પ્રવાસ પોર્ચ પુજય છે કે ઉતરા ૧૧,૦૦ તી. પછેલો સરતો, દાર્દીયા : ગ્રુપાઇલેની ના બાલ્ડનું, પ્રવા - પોર તો રવ દાર્દીયા : ગ્રુપાઇલેની ના બાલ્ડનું, પ્રવા - પોર તો રવ નાવીના, પાલિમ : પોર્ચ - ગ્રી - વસીના ચિક્ષાન વીમાં છે છે. સ્પર્ધ સંપર્ધના ભાગીદારો ચોલ્સ સામાં વાર્ષી છે છે.	ર૧.૦૧.૨૦૨૫ ૢૺ સાંકેતિક ્ર વનાણા છઆઇડીસી (પોરબંદર)
	સહી⁄ અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક			
_	(આ નોટિસનું અંગ્રેજીમાંથી અ	ન્ય ભાષામાં અનુવાદ કરતી	વખતે કોઈ ક્ષતિ થયેલ જણાશે તો કાચદાકીય રીતે અંગ્રેજી લખાણ જ માન્ય	ગભાષે)



JINDAL JINDAL WORLDWIDE LIMITED

CIN: L17110GJ1986PLC008942 Regd. & Corp. Office."Jindal House", Opp. Dmart. I.O.C Petrol Pump Lane, ShivrajiniShyamal 132 Ft. Ring Road, Satellite. Anmedabad – 380015, Gujart, India, :: 079-71001500 • Email Id : csjindal@jindatextiles.com • Website : www.jindatextiles.com CORRIGENDUM TO THE NOTICE OF POSTAL BALLOT DATED 7[™] JANUARY, 2025

Dear Shareholders.

Deer Shareholders, This is with reference to the Notice of Postal Ballot dated 7th January, 2025 issued to the shareholders of Jindal Worldwide Limited ('the Company') and ongoing e-voting available from Friday, 17' January, 2025 at0 90.0 A.((IST) which will end on Saturday, 15' February, 2025 at0 5:00 P.M. (IST). The Notice of Postal Ballot dated 7th January, 2025 ('Postal Ballot Notice') was dispatched via email to the Shareholders of the Company on 16th January, 2025, indue compliance with the provisions of the Companies Act, 2013, and rules made thereunder, read with circulars issued by the Ministry of Companies Act, 2013, and rules made thereunder, the said Postal Ballot Notice. In pursuance to the companies de Stell (LODR) Regulations, 2015 read with all such necessary amendments thereto, this Corrigendum is being issued to via the shareholders for omission of the Point no. 7 of Notes to the Postal Ballot Notes, as per the explanation below: The requirement of announcing dates of closure of transfer books in place of record date for securities held in physical form, for complying with requirements for Issue of Bonus Issue of Shares is. Regulation 42(6) v15811 (LODR) Requisitions, 2015 has been omitted by the SEBI vide its Notification No. SEBI (LODR) Requisitions, 2015 has been omitted by the SEBI vide its Notification No. SEBI (LODR) Requisitions, 2015 has been omitted by the SEBI vide its Notification No. SEBI (LODR) Requisitions, 2015 has been omitted by the SEBI vide and that the Postal Ballot Notice as circulated earlier should be read after ignoring the Point No. 7 which has been omitted through this corrigendum. This is with reference to the Notice of Postal Ballot dated 7th January. 2025 issued to the

Point no. 7 of Notes to the Postal Ballot Notice**OMITTED**

Point no. 7 of Notes to the Postal Ballot Note: "OMITED" 7. Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with relevant rules and Regulation 42 of SEBI (COR) Regulations. 2015: the Register of Members and Share Transfer Books of the Company will remain closed (Book Closure Period) from Monday, 24 February, 2025 to Tuesday, 29 February, 2025 (both days inclusive) for the purpose of Issue and allotment of Bonus shares." This Corrigendum to the Postal Ballot Notice shall form an integral part of the Postal Ballot Notice, which has already been circulated to the Shareholders of the Company, and on and form the date hered. the Postal Ballot Notice shall form an integral part of the Postal Ballot Notice, which has already been circulated to the Shareholders, Stock Exchanges. Depositories, regulators, and all other concerned persons are requested to take note of the above changes. All other contents of the Postal Ballot Notice, aver and except as modified or supplemented by this Corrigendum, shall remain unchanged. This Corrigendum dated 24' January, 2025, shall stob be available on the Company's vebsite www.indalloxtlescon, websites of the Stock Exchanges to. BSE Limited and National Stock Exchange of India Limited (ESP).

(ESP). This Corrigendum is being sent only through electronic mode to those Shareholders whose email address is registered with the Company / depository participan(s) as on the cut-off date i.e. Friday, 10⁻³, anaury, 2025. We would like to inform all those, who have already casted their voles in the ongoing postal ballot i.e. after the start of e-Voling towards the postal ballot but prior to receiving this Corrigendum to postal ballot notice, that their e-vole shall have no impact and no relation with the information provided in the Corrigendum. The omission stated in this Corrigendum is no way resulting in any change in the purpose of Special Businesses and the

proposed resolutions thereof. This Corrigendum should be read in continuation of and in conjunction with the Postal Ballo notice dated 7⁻¹ January, 2025. The above is for your information and records.

For and on behalf of the Board of Directors For JINDAL WORLDWIDE LIMITED AMIT AGRAWA

Vice-Chairman & Managing Director DIN: 00169061

HIN		HINDUJA LEYLAN કોર્પોરેટ ઓફિસા ૨૫૦ એ, કેવલપ્ક ઇન્ડસ્ટ્રિસલ એસ્ટેટ, રજિસ્ટર્ડ ઓફિસા પ્લોટ નં. સી–૨૧, ટાવર સી (૧–૩ મ	યુઈન્કી, ચેત્રાઈ – ૬૦૦૦૩૨ ાળ), જી બ્લોક, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા	(yel),
		મુંબઈ – ૪૦૦૦૫૧. વેબસાઈટ : www.hirdu.aleylandfi		221
	બાહેર	હરાજી નિયમ૮ (ક)અને ૯ (૧)હેઠ		
		વેચાણ માટે જાહેર હરાજી વેચાણ		
QIH QIR	કી લેણી સ્ક્રમની અને એની પ લાન્શિયલ એરોટ્સ એન્ડ	તા સિક્સોર્ડ દેશાની નીચે કોલમડીમાં વણાવ્યા ારના આગળના વ્યાજ કોસ્ટ અને ચાર્જેસ સહિત છેન્ફોરમિન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ન ોર્ડ અસ્ક્યામતનો કળવો લીધેલ છે. નીચે સફી	વસૂલાત માટે ધ સિક્યુરિટાઇઝેશન એન ૦૦૨ હેઠળ પોતાને મળેલ અધિકારન	ઝ રિકન્સ્ટ્રક્શન ઓર્ I કવાચત કરતા અર્ગ
ખર્ર	ોદી માટે ઓફરો મંગાવવામાં	આવે છે જે જ્યાં છે જેમછે અને જે કાંઈ છે તે છે તે	આધારે, ફિઝિકલ કબનામાં છે અને વિ	ગતો નીચે મુજબ છેઃ
S.N	. 52451	ર(શે)/ સફ-કરજદાર(શે) / જમીનદારો	બાકી રકમ (રૂપિયામાં)	અનામત કિંમત
1.	વેસુ પોઈન્ટ, વેસુ, સુરત– ૨) ઓમપ્રકાશ સોની (સ કાંગારૂ હોટેલની પાછળ, દ	& કરજદાર) સરતામુ : ૩૪, નંદનવન સોસાચ કોડ દોડ રોડ, સુરત- ૩૯૫૦૦૧.	એક કરોડ છવ્વીસ લાખ ટી, સિત્યાસી હજાર બેતાલીસ) + જ્યાં સુધી પૂરેપૂરી ચૂક્વણી ન	રૂ.૧,૫૩,૦૦,૦૦૦/ - (રૂપિયા એક કરોડ ત્રેપન લાખ)
	સોસાચટી, કાંગાર હોટેલ ૪) કિરણ મેસૂરિયા (સઠ	સોની (સહ કરેજદાર) સરનામુ : ૩૪, નંદન ી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત- ૩૯૫૦૦૧. ! કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન સોસાથ મેડ દોડ રોડ, સુરત- ૩૯૫૦૦૧.	વૈદ્યાનિક ખર્ચ + કાનની ખર્ચ +	કરાર નં. "GJSXSE00324"
		સુરક્ષિત સંપત્તિની વિગત		
	કાર્પેટ વિસ્તાર અને ૧૫૭, અવિભાજિત હિસ્સો, જે રે ૩૪/૧, ૩૪/૨, ફાઈનલ પ્લં સુરતમાં આવેલી ઓમપ્રકા	.નું વેડિસ્ટ્સલ : ગોફિસ / દુકાલ નં. ૧૦૧, પહેલો ? ૭૨ થો.મી. બિલ્ડ અપ વિસ્તાર તેની સાથે દીપઅ રાત્લ્યુ સર્વે નં. ૪૪, ૦લોક નં. ૦૨, ટી.પી. સ્કી ૧ટ નં. ૩૪/૧, ૩૪/૨ અને ૩૪/૩ પૈકી, કાઈનલ ૧ રા પુનમસંદ સોનોની માલિકીની અસલિત મિલક ૪, દક્ષિણ: ઓ.ટી.એસ., પૂર્વ: દુકાલ નં. ૧૦૧,	લ શોધિંગ અને ડોક્ટર હાઉસ (દીપકર 1 નં. ૩૮ (નાનાવરાછા) ખાતે આવેલ લોટ નં. ૩૪/૧, સબ પ્લોટ નં. ૧, મૌર્વ 1 તેના તમામ હક અને હિસ્સા સાથે ર	નલ–બી) ની જમીનમાં છે, અસલ પ્લોટ નં. ! નાના વરાછા, સીટી
	અર્બેસ્ટ મની કિયોઝિટ (EMD) (RP ના ૧૦%) (એ:	મિલકત નિરીક્ષણની તારીખ અને સગ) ૨૪ કેબ્રુઆરી ૨૦૨૫ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા ર	હરા છેમાં લોશે બે બે છે	
⊩	89981	ર(રો)/ સફ-કરજદાર(રો) / જમીનદારો	બાકી રકમ (રૂપિયામાં)	અનામત કિંમત
2.		(કરજદાર) સરનામું : ઓફિસ નંબર ૨૧૧,	(રૂ. ૧,૧૦,૦૮,૩૧૬/- રૂપિયા	3.4,43,00,000/
	વેસ્ટર્ન વેસુ પોઈન્ટ, વેસુ,		એક કરોડ સત્તર લાખ આઠ હવાર	- (રૂપિયા એક
		(સહ કરવદાર) સરતામુ : ૩૪, નંદનવન	ગણસો સોળ) + જ્યાં સુધી પૂરેપૂરી	કરોડ ત્રેપન લાખ)
	સોસાયટી, કાંગારૂ હોટેલન	ી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧.	ચૂકવણી ન થાય ત્યાં સુધીનું ચડત	કરોડ ત્રોપન લાખ)
	સોસાયટી, કાંગાર હોટેલ- 3) તારાબેન ઓમપ્રકાશ	ની પાછળ, ઘોડ દોડ રોડ, સુરત- ૩૯૫૦૦૧. સોની (સહ કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન		કરાર નં.
	સોસાયટી, કાંગાર હોટેલ- 3) તારાબેન ઓમપ્રકાશ સોસાયટી, કાંગાર હોટેલ- ૪) કિરણ મેસૂરિયા (સહ	ી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. સોની (સહ કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન દી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન સોસાચટી,	थूडवसी न थाथ त्यां सुधीनुं चडत व्याप + पेधानिङ जर्च + डानूनी	
	સોસાયટી, કાંગાર હોટેલ- 3) તારાબેન ઓમપ્રકાશ સોસાયટી, કાંગાર હોટેલ- ૪) કિરણ મેસૂરિયા (સહ	fl પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. સોની (સહ કરજદાર) સરનામુ : ૩૪, નંદનાંન fl પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન સોસાચટી, ત્રોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧.	સૂકવાકી ન થાય ત્યાં સુધીનું ચકત વ્યાજ + વેધાનિક ખર્ચ + કાનૂની ખર્ચ + આકસ્મિક ખર્ચ	કરાર નં.
	સોસાયટી, કાંગાર હોટેલન 3) લારાબેન ઓમપ્રકાશ સોસાયટી, કાંગાર હોટેલન ૪) કિરલ મેસૂરિયા (સહ કાંગાર હોટેલની પાછળ, દ	ી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. સોની (સહ કરુશદાર) સરનાષ્ટ્ર, ૩૪, નંદનવન Iી પાછળ, ઘોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. કરુશદાર) સરનાષ્ટ્ર : ૩૪, નંદનવન સોસાચટી, તોડ દોડ રોડ, સુરત– ૩૯૫૦૦૧. સુરક્ષિત સંપત્તિની વિગ્ન	ચૂકવણી ન થાય ત્યાં સુધીનું ચડત વ્યાજ + વેધાનિક ખર્ચ + કન્દ્રની ખર્ચ + આકસ્મિક ખર્ચ ો (બી)	કરાર નાં. "GJSXSE00138"
	સોસાયટી, હાંગણ હોટેલન 3) તારાબેન ઓમપ્રકાશ : સોસાયટી, કાંગણ હોટેલન ૪) કિરલ મૈસૂરિયા (સહ કાંગણ હોટેલની પાછળ, દ પ્રોપર્ટી શુનિટ-દુકાન નં. ૧	મી પાછળ, લોડ દોટ કોડ, સુરત- ૩૮૫૦૦૧. સોની (સલ કરપદાર) સરભાષ્ટ્ર : ૩૪, નંદનવન મી પાછળ, લોડ દોડ , સુરત- ૩૮૫૦૦૧. કરપદાર) સરભાષ્ટ્ર : ૩૪, નંદનવન સોસાચટી, તોડ દોડ ટોડ, સુરત- ૩૮૫૦૦૧. સુરવિશ્વ સંપત્તિની વિગ, તુ શેડ્યૂલ : ઓફિસ / દુલાન નં. ૧૦૨, પટેલો ગ	ચૂકવાલી ન થાય ત્યાં સુધીનું ચકત વ્યાપ + યેઘાનિક ખર્ચ + કાનૂની ખર્ચ + આકસ્મિક ખર્ચ તો (વી) ાળ, ક્ષેગફળ ૧૪૧૬.૫૦ થો.ફુટ એટલં	કરાર નં. "GJSXSE00138" છે ૧૩૧.૨૦ ચો.મી.,
	સોસાયટી, કાંગારૂ હોટેલ- 3) તારાબેન ઓમપ્રકાશ સોસાયટી, કાંગારૂ હોટેલ- ૪) કિરણ મેસૂરિયા (સઢ કાંગારૂ હોટેલની પાછળ, દ પ્રોપર્ટી ચુનિટ-દુકાન નં. ૧ કાર્પેટ વિસ્તાર અને ૧૫૦.	મી પાછળ, લોડ દોટ સેડ, ચુંટ્રત- ૩૮૫૦૦૧. કોલી (ચંદ કરપરા) સરામાં : ૩૩, નંદનલન મી પાછળ, લોડ દોટ સેડ, સુટત- ૩૮૫૦૦૧. કરપરાઈ, સરામાં : ૩૩, નંદનલન સોસાચતી, શેટ દોટ સેટ, સુટત- ૩૮૫૦૦૧. સુરક્ષિત સંપત્તિની વિગ્ન તું શેડસૂથ, : ઓફિઝ / દુકાન નં. ૧૦૨, ૫૯૯ેવો મ	ચૂટવાળ ને લાચ રવાં સુધીનું ચંડત વ્યાપ + પૈધાનિક ખર્ચ + કાનૂની ખર્ચ + આકસ્પિક ખર્ચ તો (dl) ાળ, ક્ષેત્રફળ ૧૪૧૬.૫૦ ચો.સુટ એટલં રાગોપિંગ અને ડોક્ટર દાઉસ (ટીપક	કરાર નં. "GJSXSE00138" ! છે ૧૩૧.૬૦ ચો.મી., નલ–બી) ની વગીનમાં
	સોસાયટી, કાંગારૂ હોટેલન 3) તારાબેન ઓમપ્રકાશ સોસાયટી, કાંગારૂ હોટેલન ૪) કિરલ મૈસૂરિયા (સહ કાંગારૂ હોટેલની પાછળ, દ પ્રોપર્થી સુનિટ-દુકાન નં. ૧ કર્માટ વિસ્તાર અને ૧૫૦, અવિભાળિત હિસ્સ), વે ર	મી પાછળ, લોક દો ક દોક, ચુરત – ૩૮૫૦૦૧. સોની (સંદ કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન મિાછળ, દ્રો ક દોક, સુરત – ૩૮૫૦૦૧. કરજદાર) સરનામુ : ૩૪, નંદનવન સોસાગ્રદી, તોક દોક રોક, સુરત – ૩૮૫૦૦૧. સુરીરત સંપત્તિની વિગ્ન તું સેડ્યુસ : ઓઝિસ / દુરાન નં. ૧૦૨, ૫૯૯૫) ૦૨ ચો.મી. બિલ્ટ આ વિસ્તાર હેનની સાથે દીધકન ત્વાસુ સર્વ નં. ૪૬, ભ્લોક નં. ૧૮, ટી.પી. સ્કી	କୁର୍ବସାମି କାଷାକ ବଧ୍ୟ କୁମ୍ମିଣ୍ଡି ସେନ ସୋବ କ ସିଧାନେ ବର୍ଷ କ କାଲୁଣା ଏହି କ ଆଗର୍ଭିକର ବର୍ଷ ስ (cfl) IIO, ଶ୍ରୀକ୍ରେମ ସହବସ୍ଥ, ଏବ ସା, ବ୍ରୁ ୧ ୬ ନିର୍ପ ଗ ଖୀସିଦା ତାମ ରାଜନେ ଜଣାଟେ (ମିଧାକ କ . ୫ ୧ (କାମସୋସେ)) ଭାଗ ତାସାର	કરાર નં. "GJSXSE00138" i કે ૧૩૧.૬૦ ચો.મી., નલ–બી) ની વમીનમાં છે, અસલ પ્લોટ નં.
	સોસાયટી, કાંગારૂ લોટેલન 3) તારાએન ઓમપ્રકાશ સોસાયટી, કાંગારૂ લોટેલન 3) કિરલ મેસૂરિયા (સહ કાંગારૂ લોટેલની પાછળ, દ પ્રોપર્દી સુનિટ-દુકાન ન. ૧ કાર્યટ વિસ્તાર અને ૧૫૭ અવિભાજિત હિસ્સો, જે રં ડાંગ(ત, ડાર/ર, ફાઈનલ પ	મી પાછળ, લોડ દોટ સેડ, ચુંટ્રત- ૩૮૫૦૦૧. કોલી (ચંદ કરપરા) સરામાં : ૩૩, નંદનલન મી પાછળ, લોડ દોટ સેડ, સુટત- ૩૮૫૦૦૧. કરપરાઈ, સરામાં : ૩૩, નંદનલન સોસાચતી, શેટ દોટ સેટ, સુટત- ૩૮૫૦૦૧. સુરક્ષિત સંપત્તિની વિગ્ન તું શેડસૂથ, : ઓફિઝ / દુકાન નં. ૧૦૨, ૫૯૯ેવો મ	ચુકવાથી ન થાસ ત્યાં સુધીનું ચંકત વ્યાજ + સેધાનિક ખર્સ + આક્સિક ખર્સ ખર્ચ + આકસ્ત્રિક ખર્ચ તે (d) ાળ, ક્ષેત્રફળ ૧૪૧૬, ૫૦ ચો. સુટ એટલ લ ગોપિંગ અને ડોક્ટટ લાઉલ (દીધાક્વ લ નો. ડ.ટ (બાબાવરાછ)) ખાતે આવેલ લ	કરાર નં. "GISXSE00138" ! કે ૧૩૧.૬૦ ચો.મી., નલ–બી) ની જમીનમાં છે, અસલ પ્લોટ નં. ! નાના વટાછા, સીટી
	સોસાયટી, કાંગણ હોટેલ્લ 3) લાશબેન ઓમ્બ્રાકાશ સોસાયટી, કાંગણ હોટેલ્લ ૪) કિરણ મેસૂરિશા (સહ કાંગણ હોટેલની પાછળ, શ પ્રોપર્દી ચુનિટ-દુકાન નં. ૧ કાર્યટ વિસ્તાર અને ૧૫૭. અવિભાલિય હિસ્સો, ૧૨ સ્ટ્રારના આવેલી ઓમ્બ્રાકા	ી પાછળ, લોકે દોર કોર, વેંસુના - કરપ૦વ. મોલી (સર કરપરાર) પ્રસ્તામુ : ગર, નંદનલન ી પાછળ, લોક દોર દોર, સુસા - કરપ૦વ. કરપરાર) પ્રસ્તામુ : ૩ર, નંદનલન સોસાસટી, 16 દોર કોર, સુસ્ત - કરપ૦વ. સુરવિત સંપત્તિની સિમ તું રોડ્યુસ : ઓકિંસ / દુકાન નં. ૧૨, વેલી ગ ૨૨ સો.ગી. બિંદર આ વિસ્તાર 2ની સાથે દીપકા વાલ્યુ સર્વ નં. ૩૪, ભોક નં. ૦૨, દોરી. સ્ટી), નં કર/વ, કર/ર અને કર/ર કોરી, ફાર્મલન	ચૂકવાથી લ શાચ ત્યાં સુધીવ્યું શંકત ત્યા + રેધાતિક ખર્ચ + કમ્તૂની ખર્ચ + આકસ્મિક ખર્ચ તો (dl) માળ, સેમકળ ૧૪૧૬, ૫૦ સો. તૂટ એટર દાપિંગ અને ડોસ્ટર દાઉંસ (ટીપક ન કટ (નાનાવરાછ) ખાતે આવેલ લોટ નંકટ (, સાળ લોટ નં. ૧, મોર્ગ	કરાર નં. "GJSXSE00138" ! કે ૧૩૧.૬૦ ચો.મી., નલ–બી) ની વમીનમાં છે, અસલ પ્લોટ નં. ! નાના વરાછા, સીટી
	સોસાયટી, કાંગણ હોટેલ્લ 3) લાશબેન ઓમ્બ્રાકાશ સોસાયટી, કાંગણ હોટેલ્લ ૪) કિરણ મેસૂરિશા (સહ કાંગણ હોટેલની પાછળ, શ પ્રોપર્દી ચુનિટ-દુકાન નં. ૧ કાર્યટ વિસ્તાર અને ૧૫૭. અવિભાલિય હિસ્સો, ૧૨ સ્ટ્રારના આવેલી ઓમ્બ્રાકા	ી માધળ, શેઢ ડોડ કોડ, સુસ્ત- કરળવન, સૌલી (લક કરપરાડ) કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કરમાં મીં લાક પ્રદેશ કરમાં કરમાં સુરે રિક્રાય કરમાં કર સાં કરમાં ક સાળ કરમાં કર	યુક્તવાની તા લાગ ત્યાં સુધીનું ચાંડત (ચા મ ર વેસાક્તિ આ માં કાસ્તુની પાર્ચ + આકસ્તિક પાર્ચ + કાસ્તુની તે (તી) તા (તો) તા (તો) (ગા) (ગા) (ગા) (ગા) (ગા) (ગા) તે (ગા)	કરાર નં. "GJSXSED0138" ાં કે ૧૩૧.૬૦ ચો.મી., લા-બી) ની વગીનમાં છે, અસલ પ્લોટ નં. ગાના વરાછા, સીટી અને તેની ચતુર્ચીમાઓ ઝંદ પોલવાની સપ્રધ
622	સોસાયટી, કોગાણ હોટેલ્લ 3) તારાબેલ ઓમધાનાં સોસાયટી, કોગાણ હોટેલ્લ 9) કિસ્સ મેં સુસ્થિત (સહ કોગાણ હોટેલની પાછળ, ત પોપાર્ટી ચુનિંદ- દુકાન નાં. ૧ કોગે હોટેલની પાછળ, તે પોપાર્ટી ચુનિંદ- દુકાન નાં. ૧ કોગે(ગ, ટેસ્ટ), કોઈનાલ પા ચુરાતમાં આવેલી ઓમધાના લોકો ચુનળ છે (ઉત્તર: પેચે અતેરક મતી ડિપોડિંડ (200) (RP ના ૧૦૪) (સેટ	ી માછળ, તોડ ડોડ ડોડ, સુંદન - કારળગર, સૌલી (ne કરપરાડ) કરમાં કરમાં કરમ કરમાં કરમ કરમાં કરમ સીલી (ne કરપરાડ) કરમ કરમાં કરમ કરમાં કરમ કરમાં કરમાં કરમ સુંદર્શ કરમાં કરમ કરમ કરમ કરમ કરમ કરમ કરમ કરમ સુંદર્શ કરમ	યુક્તવાની તા લાગ ત્યાં સુધીનું ચાંડત (ચા મ ર વેસાક્તિ આ માં કાસ્તુની પાર્ચ + આકસ્તિક પાર્ચ + કાસ્તુની તે (તી) તા (તો) તા (તો) (ગા) (ગા) (ગા) (ગા) (ગા) (ગા) તે (ગા)	કરાર નં. "GJSXSE00138" ં કે ૧૩૧.૬૦ ચો.મી., લા-બી) ની વગીનમાં છે, અસલ પ્લોટ નં. ર નાના વરાછા, સેંટી નાના વસણા, સેંટી અને તેની ચતુર્ચીમાઓ અંદ પોલવાનો સમય
	સોસાયતે, કોગણ શેટેલ્ટ 3) ભારતેન અધેમકાશ સોશાયતે, કોગણ શેટલાં આપતા કોગણ શેટેલાં માયુરિયા (હત કોગણ શેટેલાં માયવા સેવર વિસ્તાર કેળ ને થયત્ અધિગાવિત હિસ્સો, કે સુધ્ય, કાર્ય, હાંચલ પ ચુરતમાં આવેલી ઓમસ્ટા સોય મુખ્યત છે ; ઉત્તર પ સતેર થની ડિબઝિટ (Elli) (RP at 105) (સંદ	ી માછળ, તોડ ડોડ ડોડ, સુંદન - કારળગર, સૌલી (ne કરપરાડ) કરમાં કરમાં કરમ કરમાં કરમ કરમાં કરમ સીલી (ne કરપરાડ) કરમ કરમાં કરમ કરમાં કરમ કરમાં કરમાં કરમ સુંદર્શ કરમાં કરમ કરમ કરમ કરમ કરમ કરમ કરમ કરમ સુંદર્શ કરમ	बुरुववी न सार त्यां सुवीतुं संदर्भ सार + देवातील भा में अभूती भा ली - जाठसिंग भा में अभूती ते (ती) फा, सेअवल १४९१, भा से (ठूट सेटेंट मां) कि मां ने डोट्टर वार्सिंग (टीभ्रम मां) के (- जार), सार भा के अभी दिस्सा सारी म देवा तमान देठ अभी दिस्सा सारी मां सार प्रा	કરાર તાં. "GJSXSE00138" ને 434.દ્ ગ્યો.મી., (સ-ગી) ની વગીનમાં કે, અસલ પોટ નો. ને નાના વરાછા, સેટી કેને તેની ચલુર્સીમાઓ કરર ખોલવાનો સમય બપોરે 3.30 વાએ
	સોસાયતે, તે ગંગવ શેટેલ્ગ 3) ભારબેલ બોમકાશ સોસાયતે, ગંગવ શેટેલ્લ પ્રાપ્ટ શેટ સ્વા સુધ્રિયા (સંદ ગંગ ટેલ્ટરો સુધ્રિયા (સંદ ગંગ ટેલ્ટરા રંગ વેષ્ઠબ સંદ સાર્ટિંગ ટેલ્ટરા રંગ વેષ્ઠબ સંદ સ્વીલ્ટ ગ્રંગ ટેલ્ટરા રંગ વેષ્ઠબ સંદ સ્વીલ્ટ ગ્રંગ ટેલ્ટરા ટેલ્ટરા સ્વ સ્વીલ્ટ ગ્રંગ ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટ સારે ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટ સારે ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટરા ટેલ્ટર ટેલ્ટર ટેલ્ટરા ટેલ્ટર	ી પાછળ, તોડ ડોડ કોડ, સુંદન- કાયલગ, સોલી (ne કરપરા) કરવા, કંત-લાન્ન સોગાલ) સોલી (ne કરપરા) કર, તુંદન- સરબાગ, કરપરા) કરવા, કંડ, સુંદન- સરબાગ, કરપરા) કરવા, કંડ, સુંદન- સરબાગ, સુંદીત કરોપરીની (ક્રાપ્ત ની. કાર, તું રોડસુંદ્ધ, સુંદન- સરબાગ, સંગ્રે સુંદીત કરોપરીની (ક્રાપ્ત ની. કાર, તેની) તું રોડસુંદ્ધ, સુંદર અંગ કરપર, પ્રોતને) કર્ય ગોતી, બિલ્ટ અનિ (સ્ટ્રાપ્ત ની કરો), સીંદ સંગ્રે સ્ટ્રાપ્ત કર્યું કરવા ને બગ્ર સ્ટ્રાપ્ત સ્ટાર્પ કરવા છે કરો, કેરી, સીંદ સંગ્રે મારબ કર્યો કરી, સીંદ, સીંદ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ મારબ દી સંપીર્થ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ મારબ દી સંપીર્થ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ મારબ દી સંપીર્થ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ મારબ દી સંપીર્થ સ્ટાર્પ સ્ટાર સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર્પ સ્ટાર	યુક્તવાની ન લાગ રહી સુંદીનું પ્રેટને સામ ર વેદાતીક આ પાંકે કાસ્તુની પાંકે - આગસિંગ અની તે (તી) આપ, તેસેન્ગલ ૧૧૬૧, પર શે, તુટ એટલે લાંગિંગ અને ડોગ્ટર લાંધિર (દીબા- નાં, ૩૯ (નાગલરાશ)) ખાંસે ગાંતે હું -, ગ્રંગણે, તે ગાંતા નામ લંડ અને હિસ્સા સાંચે ગ વે તેમાં તામનં લંડ અને હિસ્સા સાંચે ગ વા તેમાં તેમાં લગ્ન બે દિસ્સા સાંચે ગ વા તેમાં બે બે બે બે બે સ્ટાર્ગ સે વ્યુક્ત સ્ટે ન્યૂર્ગ બે પાંડો બે	કરાર નં. "GLSXSE00138" મંદ્ર 43.4. દ્વ. ઓ.મી., સ્વ:-બી) ની વગીનમાં છે, અસલ પ્લોટ નં ગાના વરાશ, સંદેરી ભો તેની ચતુર્ચીમાઓ બરૂટેલ્શન (હેરયદાસ) અસ્ટ્રેલ્શન (હેરયદાસ)
	સોસાચંદ્ર), કરોગણ શેટેલ્લ 3) ભારબેલ બોમલામાં સોસાચંદ્ર), કરોગણ શેટેલ્લ 3) કિસ્સ મેં સુધીસા (સહ કોગણ શેટેલ્લી પાછળ, ત અંગે દિવસ કરોગણ શેટેલ્લી પાછળ, બોને શિસ્સાર અને ૧૫૦, બોને બોને શિસ્સાર અને ૧૫૦, બોને સુધરામાં આવેલી ઓમસ્ટા, સેસે સુધરામાં આવેલી આંગે હોય સામેટ સ્વર્ધ છે. (સીધી) (શિન્ના ૧૨૨) (સે સ્વરી સ્વરો સ્ટલો અને લિયોન્ટ સ્વરી સ્વરો સ્ટલો અને લિયોન્ટ	વી માયળ, તોડ ડો ડો ડો, સુંતર - કાયળગ, તો બો પાળ, તોડ ડો ડો ડો, સુંતર - કાયળગ, તો બો પાળ, તોડ ડો ડો ડો, સુંતર - તારબગ, રાજ્ય (સુંત્ર ક્લાલ) કરતા કરતા કરતા કરતા કરતા તે કે ડો ડો ડો, સુંતર - દાયળગ, સુંત્રી કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરતા	યુકલાથી તા લાચ ત્યાં સુંધીનું ચંદ્ધ તે સામ ન વૈદ્યાલીન આપે ક અનુની આપે કે અગ્ર કે બિઝા અપે તે (cf) તે (cf) (cf) (cf) (cf) (cf) (cf) (cf) (cf)	કરાર નં. "GJSXSE00138" લે. વડવ, દ્વ ઓ. મી, લલ-બી) ની વગીનમાં છે, અસલ પ્લોટ નં. 'ન્ને તેની ચલુર્ચીમાઓ અંદ ખોલવાનો સમય બપોરે 3,30 વાએ અસ્ટ્રક્શ્વ (કરવદાર), કરાર તં, કેસ્પ્લાદગ, કરાર તં, કેસ્પ્લાદગ, કરાર તં,
	સોસાચતે, તે ગંગવ લેટેલ્ગ 3) ભારભેન બાંગેમહામાં સોસાચતે, ગંગવ લેટેલ્લ ગંગ રેસ્ટલે ચાર્ચ ત્યેટલની પાછળ, પ પ્રેચિટ સુવિદ્ય-દુકાન ને. પ કાર્યદ વિકેલાર છન ૧૫૦૦ સંદર્ભા અને વિકેલાર છન ૧૫૦૦ સંદર્ભા અને વિકેલાર છન ૧૫૦૦ સંદર્ભા અને વિકેલાર છન ૧૫૦૦ સંદર્ભા અને વિકેલાર છેન ૧૫૦૦ સંદર્ભા અને વિકેલાર છેન સંદર્ભા અને વિકેલાર છેન સંદર્ભા અને વિકેલાર છેન સ્ટાર્ગ કેટલાર પ્રેચ્ન કેટ્સ અને વારતો અને ક્લામો સ્ટાર્ગ સ્ટાર્ગ સંદર્ભા સ્ટાર્ગ સ્ટાર્ગ ભારત સ્ટાર્ગ સુવિદ્ય	ી પાછળ, તોડ ડોડ ડોડ , સુંદન- કાલ્યવન. સોલી (ne કરપરા) કરવા કાલ્યું (યુક્તવાની ત લાગ ત્યાં સુવીતું પ્રેચ્ચ સામ ર વેદાતીઅ ખાં ક અકૃતી (ત)	કરાર નં. "GJSXSE00138" "GJSXSE00138" મંત્ર વ્યવ્ય ગયેલ્ય બાંગે નાં છે, અસલ પ્રદારે નાં નાં વા રાશ્ય નાં નાં તો ચાલુર્ચીમાં બો નાં તેની ચાલુર્ચીમાં બો બર્સ બોલવાની સમય બપોટે 3.30 વાર્ગ્ય બરસૂઠશ્ક્ર તો લખ્ય સ્થ બેમ્બન રાગે સ્થાન લોં બરસ્ટ શ્રે બાં લખ્ય સ્થ બેમ્બન રાગે બેલ્ય સ્થ
	સોસાયતે, તે ગંગવ લેટેલ્ન 3) ભારબેન આંગામનાં પ્ર સોસાયતે, ગંગવ લેટેલ્સ ગંગ રાગ્દે તે સ્વી સ્વીચા (સંદ ગંગ રાગ્દે તે સેસ્ટ્રીય (સંદ ગંગ રાગ્દે તે સેસ્ટ સ્વીચ્ય પ્ર અંતિ ક્વેસ્ટ સ્વીચ્ય પ્ર સાંદે તે સ્વીચ્ય સ્વીચ્ય કે સ્વીચ્ય સાંદે તે સ્વીચ્ય સ્વીચ્ય કે સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય કે સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય કે સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય કે સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સ્વીચ્ય સાંદે સ્વીચ્ય સ્વીય સ્વીચ્ય સ્વીય સ્ય સ્વીય સ	ી પાછળ, તોડ ડો ડ	યુકલવી તા લાય ત્યાં સુવીતું પ્રેટલ સામ ર વેદાદીલ્ઝ ખાવે કસ્તુની માં લી કા આઇ સિંગ અની કસ્તુની તે (તી) આ તો સુવર પ્રથમ, પર ચો તુટ એટલે લો બિર ગ પ્રથમ, પર ચો તુટ એટલે બા બિર ગ પ્રથમ, પર ચો તુટ એટલે બા બા બા બા બા બા બા બા બા બા પ્રથમ આ તો બા બા બા બા બા બા બા સામ બા બા બા બા બા બા બા બા બા સામ બા બા બા બા બા બા બા બા બા બા સામ બા બા સામ બા બા સામ બા બા સામ બા	ક્ષર તં. "GISXSE00138" "GISXSE00138" "GISXSE00138" "GISXSE00138" એ, અસલ પટોટ નં. એ, અસલ પટોટ નં. એ, અસલ પટોટ નં. એ, અસલ પટોટ નં. એ, અસલ પટે નં. એ, અસલ પટે નં. અસ્ટ અંગ્રેડ કરક વ્યાં અસ્ટ્ર બ્લેચ નં. અંગ્રેડ કરક વ્યાં અસ્ટ બંગ્રેડ કરક વ્યાં અસ્ટ અસ્ટ બંગ્ર કરક વ્યાં અસ્ટ અસ્ટ અસ્ટ અસ્ટ અસ્ટ અસ્ટ અસ્ટ અસ્ટ
	સોસમાં છે.) આગણ શેટેલ્લ ગો સારાબેલ આંગ્રેમકાર્ય છે. ગો સારાબેલ આંગ્રેમકાર્ય છે. ગો તે સારાબે સાર્ચે છે. ગો તે શેટી આંગ્રેમકાર્ય ગો તે શેર કે શે સાર્ચે છે. આંગ્રે ગો તે શેર કે શે સાર્ચે છે. આંગ્રેમ છે. આંગ્રેમ છે. આંગ્રેમ	ી પાછળ, તોડ ડોડ ડોડ , સુંદન- કાલ્યવન. સોલી (ne કરપરા) કરવા કાલ્યું (યુક્તવામે ન લાગ ત્યાં સુધીનું પ્રેચન (લાગ + વેધાતીઅ ખાં ક અકુની (લી) (લી) (લી) (લા) ન ગ કાર્યક્રિક અલે (લો) ન ગ કાર્યક્ર અંગ કાર્યક્ર અંગ કાર્યક્ર (તું) ન ગ કાર્યક્ર અંગ કાર્યક્ર (તું) ન ગ કાર્યક્ર (તું	કશર સં. (LISSEED0138" (LISSEED0138") (LISSEED0138" (LISSEED0138")
	સોસાચારી, તે કાંગણ કોરેટના 3) ભારખેને આંગામાં કાંગ સોસાચારી, કાંગણ કોરેટના સાંગણ કોરેટના માળવા, આંગા આંગા કે દ્વારા સુધીયતા (sea સાંગણ કોરેટના માળવા, આંગા આંગી કોર્ડિસ્ટાર અગ ૧૫૦, આંગી કોર્ડિસ્ટાર અગ ૧૫૦, આંગી કોર્ડિસ્ટાર અગ ૧૫૦, સાંગણ કોર્ડિસ્ટાર અગ ૧૫૦, સાંગણ કોર્ડિસ્ટાર અગ ૧૫૦, સાંગણ કોર્ડિસ્ટાર અગ ૧૫૦, સાંગણ કોર્ડિસ્ટાર અગ ૧૫ (ટાંડડાડા અટેલ અટેલ અટેલ આંગે કોર્ડિસ્ટાર અટેલ અટેલ આંગે કોર્ડ્ડ અટેલ અટેલ અટેલ અટેલ આંગે કોર્ડિસ્ટાર અટેલ અટેલ અટેલ આંગે કોર્ડ્ડ સ્ટેલ્ડ અટેલ આંગે કોર્ડ્સ સ્ટેલ્ડ અટેલ અટેલ અટેલ અટેલ અટેલ આંગે કોર્ડ્સ સ્ટેલ્ડ અટેલ અટેલ અટેલ અટેલ અટેલ અટેલ અટેલ અટેલ	ી પાછળ, તોડ ડોડ ડોડ , સુંદન - કારળગર, સૌથી (લક કરપરા) કરવા કરવા કરા , કર્ત (-en- લી પાછર, દોડ ડોડ ડોડ, સુંદન - સરખગર, કરપરા) કરવા કુંદ, સુંદન- સરખગર, ગુણિત કરેપરીની કિસ્તુ નું રોડ સુંદ્ર - સરખગર, ગુણિત કરેપરીની કિસ્તુ નું રોડ સુંદ્ર - સુંદર નાર્ડ ના સ્ટાર બાલ્ય ને સાથે તે પ્રાપ્ય ભુલ કરે નોંગી ના સાઉલ્લો ને સ્ટાર , તેને સાથે તે પ્રાપ્ય બાલ્ય સ્ટાર્ગ - સર્જ, ગાઉલ નં રહ્ય, તે તેને ક્લે કે તે સરં, સરં, સરં અને સરં, કે નોંગી ના મોઉલ્લો ને સાથે તે સરં, સરં, સરં, સરં, સરં, સરં, સરં, સરં, સરં,	યુકલાથી તા લાય ત્યાં સુવીતું ચૂકલ સામ ન વૈદ્યાલીય આ ચે કામ્યુની આ ગી કામ બે કામ બા બે કામ બે કામ બે કામ બે કામ બે કામ બાળ બે કામ બાળ	9 કાર તં. "GSSEE0138" "GSSEE0138" "GSSEE0138" "GSSEE0138" "GSSEE0138" "GSSEE138" નંગાના વરાણ, સંદેવે નંગાના વરાણ, સંદેવે નંગાના વરાણ, સંદેવે નંગાના વરાણ, સંદેવે નંગાના વરાણ, સંદેવે અંગે તેની ચતુર્વીમાઓ કદર ખેડવામાં તે બ્લ્યુ અંગે ઉઝાળ (લગ્ગ્લ્યાર્ટ્સ) અંગે ઉઝાળ (લગ્ન્યાર્ટ્સ) અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ્સ) અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્ટ)) (અંગે ઉડાળ (લગ્ન-યાર્

- ખાલપામાં આવવા. જારકુ બીકો એકર આપતા અગાઉ મિલકતની મુલાકાત લાબે અસ્ક્યામતોની સ્થિતિ/મૂલ્ય/દાઇદવા/માપાપી વગેરે વિષે પોતાની ખાતરી દ શકે છે. મિલકતની તમામવિઝતો એ. આને. મે મળેલા માહિતી મુજબ શૂપે પોડલે છે અને એકથેએ. આને. માહિતીની અંઇ ભૂલ વાબતે, સે વિજ્યન, હરભારણ, મિહતરોએ અથવા છે અન્ય સરકારો હેલાં અથવા અથવા છેલેની બાહતે વેશાય હેતમાં નિયત વાબતો વ્યાવણ તાબતે વા લિઅન નથી.
- નથી. આપર સંપર્ધા દિવાર્ગ નિસ્તાની ઓને અને વેચાને નહીં. દિવાર કિલા કરતાં નીમા ટેન્ડમે આવીવાઈ નાપાને. કરવા મેલાવ બાદ નાયરેકટ હેન્ડનને વોપપા થવો અને વેચાય નિંદુત્વર લોનક સામતાનનાં બોલાંપ્યુંદ્વોને સાધીન કરશે. જોતાંદૂત અદિકારી તોટા અને આન્ટરને કોઈદિર્ગ વ્યુ વ્યવસ્થામે મોનો અંગિકાર સુવીવાર ગયે છે. તે તેમની વચ્છેતા ખટન-ચે(એટિંગ વ્યુ પાકાપાટે પથી હ્યાંબેસ્ટ બીડાને સફળ બીડાર તરીકે પહેર કરશે. બીડાને પોતાની એફને રૂ. ૧,૦૦,૦૦૦/ (અંકે ફપિયા એક લાખ પૂર)ના

- વુંત્વદુવર કે. 10 કરવા લોકરમિલાદાર વેધાલાઉમંત પર ભાવન્વેશ, ૧૯૧૧ અને એએમલીની કલાગદર (૧-૦) અનુવાર ૧૧: દીડીએસ કાશ્યે અને તેની એમ 2 કરવુલ્લી(2020) માં ઘલનામાં ભા કારળેને ટીડીએસ સર્દિફેટેન્દ્રી ખસર સ્પ્રેષ્ઠ કિન્દુત્વ લેવેન્ડ ફાલનામ બિનિટેન (૨.૫૦.૦૦ વાળની અને એવી ઉપની બિક્સ (૧૯૫૯) ભા રાગ્લાન, ૧૧) ટેન્ટર/બોર્ડ એમેં એમવા અને મિલ્કલના નિવેશમ માટે પાછ્ય લોકર બહિતુ સ્પશ્ચિત થી પીસર લીક દળદલ્કર કોપપાલ કમારાપ્તા દિવસે ઓફેસ સ્પાર કારીમાન્ડ અને મિલ્કલના પ્રારંગ પાછ લોકરો અધિતુત સ્પશ્ચિત છે. દેશને સોફેસ સ્પાર કારીમાન્ડ અને મિલ્કલના પ્રારંગ પાછ કરવામાં આવે લેક્સ સ્પાર પ્રાપ્ત ક્યાં લોક ક્યાં કરવામાં ક્યાં કરવામાં ક્યાના આવે લોક લોક પ્રાપ્ત ૨૦) આ વેચાવનોટિસ વેઠામાટ (પાજ્ય.hindajakylandinance.com) પર સ્પલોડ\પ્રકારીત અલેલ છે. અધિતુન અધિકારી,

અધિકૃત અધિકારી, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ લિમિટેક તારીખઃ ૨૫.૦૧.૨૦૨૫, સ્થળઃ અમદાવાદ